

વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો.

મેટા થા બળકની ઉચ્ચ અને વજનની ટબે. બળકનું જનમ સમયનું વજન તેના વક્રિસનું પથ અંતરિ બંધુ છે. જનમ સમયે ગમે તેટલું વજન હોય પણ બળકોના વક્રિસનો દર લગભગ બંધન સંબંધ હોય છે. સમગ્ર વક્રિસનો નુનનો બળકોને બંધે બંધ ખોથક અને પૂથી દેખાતા ઉપર આધરતિ છે. તેજત બંધી, ભૂખ્યે, ગંભીર અવગણના અથવા ભવનાત્ મ્ ગડબડ તેના વજનના ઘટની વૃદ્ધિ ધકિશે.

વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો.

વિકાસ :	વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો :	વિકાસ :
જનમ સમયે વજનની સાથે	જનમ સમયે શૂઆતજનમ સમયે	વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો.
ઘટાડો ૪૦ ગ્રામ દરેક દવિસે ૧	વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો	૩.૦ કલો,
વધથે ૪૦ ગ્રામ દરેક દવિસે ૬ થી ૧૦	વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો	૩.૨ કલો,
વધથે ૩૦ ગ્રામ દરેક દવિસે અથવા ૧૦	વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો	૩.૩ કલો
ટે મ્હનિ વજન	૪.૬ કલો,	વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો.
તે થા મ્હનિ વજન	૫.૫ કલો.	

વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો.

ઉચ્ચ થા તે પણ બળકના વક્રિસના નુનનો સમવેશ છે. વજન વધુ તેજ ફકત બળકોના વક્રિસના મથ ગની આકથી કથુતનથી. બળકો સંપૂથ ઇપલે મેટા થા મટે છે નહી કે ફકત તજાડા અને જાડા. બળકનું વજન તેની ઉચ્ચ કથત ઝડપથી વધે છે. જનમ સમયે બળકનું ગમે તેટલું વજન હોય, તે લગભગ ૨ સેન ટીમેટર (૩/૪ ઈર) દર મ્હનિ વધશે અથવા લગભગ તે થા મ્હનિમં ૫ સેન ટીમેટર (૨ ઈર) વધશે. બળકનું સાધથપલે વજન અને ઉચ્ચ વધમાની ટબં સુસંગતથી તે સંબધ છે.

વિકાસ સંસ્થાના વિકાસ કાર્યકરો :

- પૂથ વ અવધવાળા બળકો : તેની ધવવાની શૂઆતબુ ધીમેથી થય છે અને તે તે વક્રિસ પણ. તેનું વજન લાંબ સમ્ય સુધી છે શ્હેવાની સંથતિમં થ્હે છે.
- બળકો જનમ સમયે પછી ભૂતજ બંધ પડે છે અથવા પહેલા અઠવાડીયામં આ બળકોનું વજન વધમામં છે પડે છે અથવા ખથેખથ કેટલુક છે પડે છે. સાથી દેખાતા ઝડપથી કદાર આગળ વધશે "વક્રિસને પકડીને" તે તે બળકનો વક્રિસ તગિતવક્રિસ સાધથથથી તે સામન્ય સંથતિમં ઉપર જાય છે.
- બળકો જે જનમ સમયે બટલીમં પીવે છે : આ બળકોનું શૂઆતમા દવિસોમં કદાર વજન છે થય છે. થેડા દવિસો મટે કદાર વજન વધુ બ્તવશે. શૂઆતથી તેનું વજન કદાર ઝડપથી વધશે, જે તેને આપવામં આવત ખોથક ઉપર અધરતિ છે. બળકોના વજનમં કદાર ક સથબો વધથે થશે, જ્યાં તેના વધથે જલદ દુધમં ઘટત ખોથકનો ઉમેથે થશે.

તેના ધીયાનમં આવે તેની ઉચ્ચના વધથમં વજનની તુલનમં ફથક છે. તે બળક જેનું વજન પથ શ્કુતના ધથવા કથત વધથે પથ થપ તકથે છે તેની સથમાથીમં તે ઉચ્ચ નહી મેળવી શકે.